

## દીર્ઘ પ્રણવોચ્ચારણી દિવ્ય મહત્તમા

યોગશારાત્રનો પ્રારંભ કરતાં પહેલાં હું વખતે આપણો દીર્ઘપ્રણવોચ્ચાર કરીએ છીએ. પ્રણવની મહત્તમા કેટલી જરૂરજરત છે તે યોગના જિજ્ઞાસુઓ જાણો છે. યોગના જિજ્ઞાસુઓ માટે ઓમ્ની ઉપાસના બતાવવામાં આવી છે - કહેવામાં આવી છે. ઓમના સાર્થક જપથી ધિણો અને ઉપધિણો ટળી જાય છે. વળી એ ઓમ્ભૂં, પરમાત્માબોધકિષાયક જે જે કાંઈ છે તે સર્વે, છુપાયેલું છે - ગોઠવાયેલું છે; તે બધાનો તેમાં સમાવેશ થઈ જાય છે. ઓમ્ભૂં શાબ્દ સિવાય બીજા ઘણા બધા ઈશ્વરવાચક શાબ્દો છે. પરંતુ તે બધા સંકીર્ણ અર્થાતા છે. 'ઓમ્ભૂં' શાબ્દથી જેટલા વ્યાપક અને ઉદાર અર્થો વ્યકૃત થઈ શકે છે જેટલા અર્થો બીજા કોઈપણ શાબ્દથી વ્યકૃત થઈ શકતા નથી. તેથી ઈશ્વરની ઉપાસના ઓમ્ભૂં શાબ્દથી જ કરવાનું યોગાભ્યાસીને કહેવામાં આવ્યું છે તે બરાબર છે. ઓમનો દીર્ઘ ઉચ્ચાર કરવાથી શારીરમાં ઘણાં બધાં રહુસ્યાત્મક કંપનો અને રૂપંદનો થાય છે.

ઓમ્ભૂં ત્રણ અક્ષરો આવેલા છે. 'અ', 'ઉ', અને 'મુ' ; તેમાં મુ અડધો છે. એ 'મુ' ને બોલતી વખતે જને હોઠ બંધ કરવા પડે છે અને બંધ કર્યા પછી જો ખોલીએ નહિ તો અડધા 'મુ' નો ઉચ્ચાર બરાબર થાય છે. પણ હોઠ બંધ કરીને પછી ખોલીએ તો 'મુ' માં 'અ' ભાળી જાય છે 'મુ' વ્યંજનમાં 'અ' રૂપર ભાળી જવાથી તે આખો ( મ ) થઈ જાય છે. દરેક વ્યંજનમાં રૂપર હોવો જોઈએ. રૂપરની સહાયતા ધિના કોઈ વ્યંજનનું અદ્વિતીય જ નથી, અને કદાચ પ્રયત્ન કરીએ તો અડધો જ જોલી શકીએ. 'અ' રૂપરની સહાયતા ધિના વ્યંજનનો ઉચ્ચાર ન કરી શકીએ. બધા જ વ્યંજનો 'અ' ની સહાયતાથી જ બોલી શકીએ છીએ. તમામ વાણી બોલવા માટે 'અ' ની જરૂર પડે છે. તેના ધિના વાણી ન બોલી શકીએ આ રીતે વાણીનો મૂળ આધાર છે. તે ઓમ્ભૂં આવતો 'અ', અ ની આટલી મોટી મહત્તમા છે. તો ઓમ્ભૂં આ ત્રણ અ, ઉ અને મુ અક્ષરોનો બનેલો છે.

'મુ' એમ બોલીએ છીએ ત્યારે બોલતાં પહેલાં હોઠને બંધ કરવા પડે છે. ઓમ્ભૂં... ઓમ્ભૂં... ( હોઠ બંધ હોય તે રીતનિમાં ) તો તેમાં મુ અડધો આવ્યો. પછી હોઠને ખોલીએ અને બોલીએ તો મુ માં અ આવી ગયો, આખા મ નો ઉચ્ચાર થાયો. પરંતુ જો અડધો મુ બોલવો હોય તો હોઠ બંધ જ રાખવા પડે.

અ, ઉ અને મુ બોલતી વખતે જ્યારે હોઠ બોગા થાય ત્યારે હોઠને બંધ રાખીને જ ધનિને ચાલુ રાખીએ તો તે ધનિથી ( ગુજરાથી ) મેરુંદમાં એવાં અતૌછિક અને દિવ્ય રૂપંદનો થાય છે કે જેથી આરોગ્ય અને જ્ઞાનની પ્રાપ્તિમાં ઘણી સહાયતા મળે છે. તેનાથી અતીનિદ્રય જ્ઞાન ( નિદ્રયો દ્વારા જે જ્ઞાનની પ્રાપ્તિ નથી થઈ શકતી એવું જ્ઞાન ) પ્રાપ્ત કરવા માટે જેવા અધિકારની જરૂર છે એવો અધિકાર પ્રાપ્ત થાય છે. તેવો અધિકાર પ્રાપ્ત કરવા માટે સુષુપ્તિમાંનાં અમૃત કેન્દ્રો જાગૃત થાવાં જોઈએ. ઓમના દીર્ઘ ઉચ્ચારથી તે કેન્દ્રોને ઉત્તેજિત કરી શકાય છે; તે કેન્દ્રોને ઉત્તેજિત કરી તેમાં જાગૃતિ લાવી શકાય છે.

દીર્ઘ પ્રણવોચ્ચારથી તે કેન્દ્રોગાં એવો અધિકાર આવે છે કે જેથી અતીનિદ્રય જ્ઞાનની પ્રાપ્તિમાં સહાયતા મળે છે. દીર્ઘ પ્રણવોચ્ચાર વખતે, બંધ હોઠે મુ નો ગંજારવ થતો હોય ત્યારે મેરુંદ ઉપર આંગળી રાખીશું તો ખ્યાલ આપણો કે તેમાં કેવી જ્ઞાનજ્ઞાની થઈ રહી છે, કેવાં કંપનો થઈ રહ્યાં છે. તે કંપનોથી મેરુંદ ઉત્તેજિત થાય છે. યોગશારાત્રમાં બોતેર કરોડ નાડીઓનો જે ઉત્તેખ છે તેમાં ઈડા, પિંગળા અને સુષુપ્તિએ મુખ્ય કહેલાં છે. સુષુપ્તિમાં પણ ધિત્રા, વજી અને ખ્રિન જાડી છે તે મુખ્ય છે. ખ્રિન નાડીમાં થઈને કુંડલિની મરતકમાં જાય છે. મૂલાધારમાં રહેતી કુંડલિની ( સુપ્ત શક્તિ) નું જાગરણ થાય છે. કુંડલિની એટલે કુંડલ વળીને પડેલી હોય તે એટલે કે જે શક્તિથી હજુ

આપણો કામ નથી લેતાં તે. જે અને જેટલી શાક્ષિતાઓ આપણામાં છે તે કર્વ શાક્ષિતાઓ દ્વારા આપણો કામ નથી લેતાં. જેટલી શાક્ષિત છે તેનાં અમુક અંશાને જ વાપરી રહ્યાં છીએ, બાકીની તો ઘણી બધી શાક્ષિત એમને એમ જ અનામત પડેલી હોય છે. અનામત પડેલી તે શાક્ષિત, તેનો પણ ઉપયોગ કરી શક્યો તેનું નામ કુંડલિની જાગરણા.

આમાં ( આ શાક્ષિતમાં ) નથી તો કાંઈ જાગરણ કે નથી તો કાંઈ ઉદ્ય. આ તો રસ્થૂળ શાબ્દો છે; વાતચીતના સહારા માટે શાબ્દોનો ઉપયોગ કર્યા પિના છૂટકો નથી, તેથી જાગરણ અને સુપત શાબ્દ વપરાયા છે. આમ તેના માટે 'કુંડલિની' તે મુખ્ય શાબ્દ છે. કુંડલિની એટલે કે કુંડલ વળીને પડેલી - કંકોચાઈને પડેલી. આપણા લુપનમાં આપણો જે કાંઈ કરી રહ્યાં છીએ તેમાં આપણામાં રહેલી જે શાક્ષિત છે તેનો અમુક અંશ જ આપણો વાપરીએ છીએ. ચાહે મોટા કાય થઈ જઈએ કે ચાહે મોટા પ્રોફેસર; ચાહે મોટા ડોક્ટર થઈ જઈએ કે ચાહે મોટા વકીલ; ચાહે મોટા વૈજ્ઞાનિક થઈ જઈએ કે ચાહે મોટા એટિજનયર; તે કર્વમાં શાક્ષિતના અતિ અલ્પ અંશાનો જ ત્વય થાયો. બાકીની બધી પડી રહી. તે શાક્ષિતનો પણ જો આપણો ઉપયોગ કરી શકીએ તો આપણી કુંડલિની જાગી છે તેમ સમજવું. "કુંડલિની શાક્ષિતની જાગૃતિ" નો સાચો અર્થ આ છે.

આમ, ઉપર જે દીર્ઘ પ્રશાવના ઉરચાઓની વાત આવી તેનાથી મેરાંડમાં પિશોખ કંપનો થાય છે કે જેથી તેમાં રહેલી સુધુમણા નાડી અને સુધુમણાની અંદર રહેલી ચિત્રા, વજ્ઞ અને પ્રભી નાડી છે ત્યાં સુધી ઠેઠ તેની ઉત્તેજના, તેની ગતિ, તેની હલચલ પહોંચે છે અને તેથી તે શુદ્ધ-પરિશુદ્ધ થાય છે. એનું પરિશુદ્ધ થાયું એટલે સૂક્ષ્મ પ્રાણો ( પિંડુતશાક્ષિતનો ) તેમાં પ્રવેશ થઈ શક્યો, પ્રવેશ થઈ શકે એવી રિથાતિમાં તેનું થાયું. દીર્ઘ પ્રશાવોચચારની આવી જબરજસ્ત મહત્ત્વા છે. તેથી યોગસાધકો માટે ઈશ્વરની ઉપાસના, ગુરુચોના ગુરુની ઉપાસના, પરમગુરુની ઉપાસના 'ઓમ્' ઈ કરવાની કહી છે. ઈશ્વરનું મુખ્ય નામ ઓમ્ છે જે ઈશ્વરના સાચા અર્થનો બોધ કરવવાવાળું છે. આ રીતે ઓમની ઘણી મોટી મહત્ત્વા છે.